

# "SUDARSHAN"

Weekly E-bulletin of Rotary club of Surat

4th March 21-22

**Rotary**  
club of Surat



SERVE TO CHANGE LIVES

Issue -31

R.I. President  
**Shekhar Mehta**

District Governor  
**Santosh Pradhan**

President  
**Bhishma Jariwala**

Hon. Secretary  
**Nikhil Madrasi**

Editor  
**R'ann Manjari Desai**

We meet every Friday  
Dr. Sarosh Bhacca Memorial Rotary Hall,  
Jeevan Bharti School Annexe, Timaliawad,  
Nanpura, Surat - 395001  
For Private Circulaion only

## ટીમના મેમ્બર્સના નામ

ગુરુવાર,તા. ૧૭/૦૨/૨૨ - મંથન શેઠની યાદમાં બોક્સ ક્રિકેટનું આયોજન થયું. ભીષ્માબેન - નિખિલભાઈ ના રોટરી બ્લાસ્ટર્સ, કુંદનભાઈ અને ભૂપેન્દ્રભાઈના રોટરી જરી જરી, રૂપેશભાઈ અને હર્ષદભાઈના રોયલ રોટેરિયન્સ અને નેહા - મંજરીના રોટરી સુપરસ્ટાર્સ સફેદ, લાલ, ભૂરા અને કેસરી રંગના વસ્ત્ર પરિધાન સાથે અદમ્ય ઉત્સાહ અને જોશ સાથે આવી પહોંચ્યા. અલગ-અલગ ગ્રુપમાં ફોટોગ્રાફી થી માહોલમાં આનંદ આનંદ અને જીતવાની તમન્ના ઓર વધી. લાલભાઈ કોન્ટ્રાક્ટર ગાઉન્ડમાં વોર્મઅપ શરૂ થયું, જાણે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટરો વોર્મઅપ કરી રહ્યા હોય એવું રોમાંચક દ્રશ્ય સર્જાય ગયું. પ્રેક્ષકો પણ આવી પહોંચ્યા. નિયમો ની ચર્ચા બધી ટીમના ઓનર્સ અને કેપ્ટન્સ વચ્ચે થઈ અને નિયમો ઘડાયા. મહિલાની બોલિંગ વખતે બેટસમેને ઊંધા હાથે રમવાનું, સુપર ઓવર, યોગ્ગા, છગ્ગા, આઉટ... બધું નક્કી થઈ ગયું. એક પછી એક મેચ શરૂ થઈ. ચિલ્લમચિલ્લી, તાળીઓ, ભૂમાભૂમ થી પ્લેયર્સને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આહાહાહા... કેવો જોમવંતો માહોલ. તેમાં નિખીલભાઈની કોમેન્ટરી - વાહ... મજા આવી ગઈ. કોમેન્ટરીમાં મૃણાલ કોઠારી અને મંથન મદ્રાસીએ પણ સાથ આપ્યો. ફુલ પાંચ મેચ રમાય.

નેહા - મંજરીના સુપરસ્ટાર્સ, મિહિર જરીવાલાની કેપ્ટનશીપ હેઠળ મોટી રનસંખ્યા સાથે વિજેતા થયા. રનર્સ અપ ટીમ હતી- ભીષ્માબેન અને નિખીલ ભાઈ ના રોટરી બ્લાસ્ટર, જેના કેપ્ટન હતા ઋત્વિક જરીવાલા. માધવ જરીવાલા - મેન ઓફ ધી મેચ અને ધ્વનિ બક્ષી વુમન ઓફ ધી મેચ જાહેર થયા... બીજી બાજુ પાઉભાજી, પાણીપુરી, કોકો, ગાજરનો હલવો અને પુલાવ ની મિજબાની ચાલુ હતી. આ વખતે ભોજન સમારંભ ભૂપેન્દ્રભાઈ, રૂપેશભાઈ અને રજતભાઈ કોઠારી તરફથી હતો. દક્ષાબેન અને કુંદનભાઈએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની વ્યવસ્થાની જવાબદારી લઈ લીધી અને મેચના અંતે આ ક્રિકેટ ગાઉન્ડનો ખર્ચો અમો કરીશું એવી જાહેરાત કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. રોટેરિયન ચંદ્રેશભાઈ શેઠે તેમના સુપુત્ર મંથનની યાદમાં આ સમગ્ર ટુર્નામેન્ટ સ્પોન્સર કરીને ખૂબ મોટું યોગદાન આપ્યું અને આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે જેણે ખૂબ જહમત ઉઠાવી છે એ ચતુષ્કોણ હતો નેહા લોટવાલા, વિનીત પંચાલ, મેઘલ બક્ષી અને મિહિર જરીવાલા. ખરેખર મોજના મેળામાં - મનમોજી મસ્તીમાં સૌ આનંદવિભોર થઈ ગયા.

### રોટરી બ્લાસ્ટર્સ

ટીમના ઓનર્સ - ભીષ્મા જરીવાલા  
નિખિલ મદ્રાસી  
કેપ્ટન - ઋત્વિક જરીવાલા  
રમતવીરો - કેતન પટેલ  
અલ્પેશ શેત્રંજીવાલા  
મેઘલ બક્ષી  
ખુશ ચૌહાણ  
ઉમંગ દલાલ  
કર્વી કોઠારી  
દક્ષા શાહ

### રોટરી જરી જરી

ટીમના ઓનર્સ - કુંદન શાહ  
ભૂપેન્દ્ર જરીવાલા  
કેપ્ટન - મૃણાલ કોઠારી  
રમતવીરો - ડૉ. હરિશ ચૌહાણ  
ડૉ. અજય મહાજન  
કુંદન શાહ  
ભૂપેન્દ્ર જરીવાલા  
મંથન મદ્રાસી  
ધ્વનિ બક્ષી  
નિકિતા દલાલ

### રોયલ રોટેરિયન્સ

ટીમના ઓનર્સ - રૂપેશ જરીવાલા  
હર્ષદ કિનખાબવાલા  
કેપ્ટન - વિનીત પંચાલ  
રમતવીરો - જય મિસ્ત્રી  
કેતન જરીવાલા  
રૂપેશ જરીવાલા  
શિવ મહેતા  
અભિષેક જરીવાલા  
ટીજલ કોઠારી  
રિયા શાહ  
નિખિલ મદ્રાસી

### રોટરી સુપર સ્ટાર

ટીમના ઓનર્સ - નેહા લોટવાલા  
મંજરી દેસાઈ  
કેપ્ટન - મિહિર જરીવાલા  
રમતવીરો - મહેશ માલી  
ક્લિદયમ દેસાઈ  
માધવ જરીવાલા  
હર્ષ પટેલ  
પુરવ જરીવાલા  
નેહા લોટવાલા  
લીના શાહ



PEACEBUILDING AND  
CONFLICT PREVENTION



DISEASE PREVENTION  
AND TREATMENT



WATER, SANITATION,  
AND HYGIENE



MATERNAL AND  
CHILD HEALTH



BASIC EDUCATION  
AND LITERACY



COMMUNITY ECONOMIC  
DEVELOPMENT



ENVIRONMENT

## બાલ આંગણવાડી

### ‘ભૂલકાઓનું સ્મિત’

શનિવાર, તા. ૨૬.૦૨.૨૦૨૨

સૌના અનુભવ પ્રમાણે આંગણવાડીના ભૂલકાઓ સાથેનું મિલન પ્રેમભર્યું અને યાદગાર હોય છે. તેજ રીતે પૂર્ણિમાબેન ગાંધી અને જાગૃતિબેન ગાંધી ની મુલાકાત પણ બાલ આંગણવાડીના ભૂલકાઓની સ્મૃતિમાં અંકાઈ ગઈ. ભૂલકાઓના કલરવ વચ્ચે એમનો ઉલ્લાસ અનુભવાતો હતો, જાણે શૈશવના જીવન-સંગીતના સૂર રેલાતા હતા. મધુર હાસ્ય સાથે સરસ્વતીના બાળકોને નાસ્તો ધરી દેતા રો. પૂર્ણિમાબેન ગાંધી ને આનંદ થયો.

### ‘કપડાં વિતરણ’

ગુરુવાર, તા. ૨૪-૦૨-૨૦૨૨

રોટરી ક્લબ ઓફ સુરતના બધા રોટરી પાર્ટનર્સ ભેગા થયા અને પોતાની પાસે તથા આજુબાજુ થી સારા કપડા ભેગા કર્યા. ‘રોટી, કપડા ઓર મકાન’ આ ત્રણ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. રોટરી ક્લબ રોટી આપવામાં તો કાર્યરત છે પણ સાથે સારા કપડા ગરીબ બાળકોમાં વહેંચી એમને આનંદ આપવામાં પણ ભાગીદાર થાય છે. ગભેણી પ્રાથમિક શાળાના બાળકોને આ રીતે જમા કરેલા કપડા વહેંચી એમને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે.

## ભૂખ્યા ને ભોજન

ગુરુવાર, તા. ૨૪-૦૨-૨૦૨૨

કોઈપણ ભોજન યજ્ઞમાં આહુતિ આપવી એ એક માનવતાનું કાર્ય છે. ઉદાત્ત ભાવના અને કરુણાથી આપવું એનું મોઢેરું મુલ્ય છે. આવા સદ્કાર્ય કરીને જીવને ખૂબ ટાઢક થાય છે. રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા નિરંતર ચાલતા પ્રોજેક્ટ ‘ભૂખ્યાને ભોજન’ માં રો. રાજેન શાહે પોતાનો ફાળો આપી કરુણાભર્યું માનવતાનું કાર્ય કર્યું છે. સાથે દર વખતની જેમ રો. દક્ષાબેન અને રો. કુંદનભાઈએ હાજર રહી સદ્કાર્યની મહેકનો અનુભવ કર્યો છે.

## Inspiration

"God and Science both take us towards the truth and reality of life. God is important for spirituality and science is important for material progress. Both are important in life."

**- Dr. A.P.J. Abdul Kalam**



Reena Mali – 6<sup>th</sup> March 2022

Minaxi Shetranjiwala – 7<sup>th</sup> March 2022

Sonal Halvawala – 9<sup>th</sup> March 2022

## SAD NEWS

Past RI President Bhichai Rattakul Passed away on Monday, Feb 28, 2022.

Rtn. Bhichai Rattakul served as RI President in the year 2002-03. Bhichai Rattakul also served as the Deputy Prime Minister from 1983 to 1990 and 1997 to 2000, Speaker of the House of Representatives and President of the National Assembly of Thailand. Bhichai Rattakul gave the Rotary World the beautiful theme "Sow The Seeds of Love"

May his Soul Rest in Peace



Mayoor Modi & Bharti Modi 6<sup>th</sup> March 2022

MARCH IS



# WATER AND SANITATION MONTH

"Clean water, the essence of life and a birthright for everyone, must become available to all people now."

Jean-Michel Cousteau



www.rotary.org

Chief-Sponsor  
*Signature.*

**CYCLOFUN**  
Rotary Club of Rajkot Midtown  
2022

Rotary District-3060  
SERVE TO CHANGE LIVES

**FREE REGISTRATION**

FOR REGISTRATION  
[WWW.CYCLOFUN.ORG](http://WWW.CYCLOFUN.ORG)

100 KM 50 KM 25 KM 10 KM 5 KM

GET READY FOR  
WORLD'S BIGGEST  
-VIRTUAL CYCLING EVENT-

20 MARCH

MORE DETAIL  
+91 74055 13468

- WE DONATE ₹2 FOR EVERY KILOMETER -  
₹1 FOR YOUR RIDE TO DONATE MEDICINE FOR THE PEOPLE IN NEED  
₹1 FOR YOUR RIDE TO DONATE BOOKS FOR THE GIRL STUDENT IN NEED

Co-Sponsor: **BALAJI SAFETY**

In Association With: **BAN** SINCE 1986

Partner Club: **RAJKOT Cycle Club**

Powered By: **FIT INDIA**

INDIA CYCLES 4 CHANGE CHALLENGE